

ચાલો જઇએ, પાઠશાળા



ચાલો જઇએ, ચાલો જઇએ,
અભંગદ્વાર પાઠશાળા

હૈયામાં બહુમાન ભરીને,
જ્ઞાન તણાં વિનયને ધરીને,
જીવનને મંગળમય બનાવવા,
ચાલો જઇએ, અભંગદ્વાર પાઠશાળા

પ્રભુ વચનોના પાવન જળમાં
ગુરુ ચરણોના નિર્મળ પથમાં
આતમને ઉજાગર કરીએ
ચાલો જઇએ, અભંગદ્વાર પાઠશાળા

સહજ મળ્યું તે

સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું,
ખળખળતા ઝરણાનું પાણી અમરત માની પીધું !

આવળ-બાવળનાં ફૂલોમાં રૂપ ગુલાબી દીઠાં,
વનવગડામાં ભમતાં લાગે ચણીબોર પણ મીઠાં !

ક્ષણ ક્ષણ જીવન ડંખે એવું કરમ ન એકે કીધું,
સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું.

ચપટી મળ્યું તે ગજવે ઘાલ્યું, મણ ની લાલચ છોડી,
આતમને અજવાળે મેં તો ધરમ ધજાયું ખોડી !

આડો-અવળો મારગ મેલી જાવું છે ઘર સીધું,
સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું !

- શ્રી લાલજી કાનપરિયા, 'કુમાર' માસિક

(૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન

(મહાવિદેહ ક્ષેત્ર સોહામણું - એ દેશી)

જગજીવન જગવાલહો, મરૂદેવીનો નંદ; લાલ રે,
મુખ દીઠે સુખ ઉપજે, દરિશણ અતિહી આણંદ; લાલ રે.
જગજીવન જગવાલહો. ૧

આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિસમ ભાલ; લાલ રે,
વદન તે શારદ યંદલો, વાણી અતિહિ રસાળ; લાલ રે.
જગજીવન જગવાલહો. ૨

લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર; લાલ રે,
રેખા કર ચરણાદિ કે, અભ્યંતર નહિ પાર; લાલ રે.
જગજીવન જગવાલહો. ૩

ઇંદ્ર યંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લેઈ ઘડીયું અંગ; લાલ રે,
ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉતંગ; લાલ રે.
જગજીવન જગવાલહો. ૪

ગુણ સઘળા અંગીકર્યા, દૂર કર્યા સવિ દોષ; લાલ રે,
વાચક જશવિજયે થુણ્યો, દેજો સુખનો પોષ; લાલ રે.
જગજીવન જગવાલહો. ૫

- મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ

(૧) શ્રી ઋષભદેવ જિન સ્તવનનો અર્થ

જગતના જીવનરૂપ, જગતને વહાલા એવા શ્રી ઋષભદેવ પ્રભુ મરૂદેવી માતાના સુપુત્ર છે. તેમનું મુખ જોવાથી સુખ ઊપજે છે અને દર્શન કરવાથી અતિશય આનંદનો અનુભવ થાય છે. ૧

પ્રભુનાં નયનદ્વય કમળની પાંખડી સમાન છે, પ્રભુનું લલાટ અષ્ટમીના ચન્દ્ર જેવું છે, પ્રભુનું વદન શરદ ઋતુના પૂર્ણ ચંદ્ર જેવું છે અને તેમની વાણી અત્યંત રસ પેદા કરનારી છે. ૨

પ્રભુના પુણ્યદેહે એક હજાર ને આઠ ઉત્તમ લક્ષણો શોભે છે. હાથ-પગનાં તળિયાં પર અનેક પ્રકારની શુભ રેખાઓ હોય છે. આ બધાં તો બાહ્ય લક્ષણો છે, જ્યારે આંતરિક લક્ષણો યાને આત્મિક ગુણોનો તો કોઈ પાર જ નથી. ૩

માની લઈએ કે ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય અને મેરૂ ગિરિના ગુણો લઈને પ્રભુનો પુણ્યદેહ ઘડવામાં આવ્યો હોય, પણ આવું ઉત્કૃષ્ટ ભાગ્ય ક્યાંથી આવ્યું ? એ મોટું આશ્ચર્ય છે. ૪

એ પ્રભુએ સર્વ ગુણોને સ્વાધીન કર્યાં છે, દોષ માત્ર દૂર કર્યાં છે. વાયક શ્રી યશોવિજયજી મહારાજે એ પ્રભુને સ્તવ્યા છે અને પ્રાર્થના કરતાં કહે છે કે હે પ્રભુ ! અમારા આત્મિક સુખની પુષ્ટિ કરો. ૫